

B.A. Semester - 4 (CBCS) Examination

March/April- 2019

ECONOMICS: P9 ECONOMICS OF PUBLIC FINANCE - 2
(Elective-1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	કરદાનક્ષમતા એટલે શું? કરદાનક્ષમતાને અસર કરતાં પરિબલો સમજાવો. અથવા	(૧૪)
પ્રશ્ન-૧	જાહેર અર્થવિધાનનો અર્થ આપી જોહેર અર્થવિધાનનું સ્વરૂપ સમજાવો.	
પ્રશ્ન-૨	ખાનગી અર્થવિધાન અને જાહેર અર્થવિધાનનો અર્થ આપી તેની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. અથવા	(૧૪)
પ્રશ્ન-૨	મહત્તમ સામાજિક સુખાકારીનો સિદ્ધાંત આકૃતિ દ્વારા સમજાવો.	
પ્રશ્ન-૩	પ્રત્યક્ષ કર એટલે શું? પ્રત્યક્ષ કરનાં લાભ અને ગેરલાભ સમજાવો. અથવા	(૧૪)
પ્રશ્ન-૩	પરોક્ષ કર એટલે શું? પરોક્ષ કરનાં લાભ અને ગેરલાભ સમજાવો.	
પ્રશ્ન-૪	કરાઘાત, કરસંપાત અને કર વિવર્તનનાં ખ્યાલો ઉદાહરણ દ્વારા સમજાવો. અથવા	(૧૪)
પ્રશ્ન-૪	જાહેર ખર્ચનો અર્થ આપી, જાહેર ખર્ચમાં વૃદ્ધિ થવાનાં કારણો ચર્ચો.	
પ્રશ્ન-૫	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧) જાહેર અર્થ વિધાનનું કાર્યક્ષેત્ર. (૨) કરવેરાનાં સિદ્ધાંતો. (૩) જાહેર આવકનાં સ્ત્રોતો. (૪) જાહેર ખર્ચનાં સિદ્ધાંતો.	(૧૪)

ENGLISH VERSION

Que-1	What is taxable capacity? Explain the factor affecting to taxable capacity. OR	(14)
Que-1	Give meaning of public finance and explain the nature of public finance.	
Que-2	Give the meaning of private finance and public finance and clear the difference between them. OR	(14)
Que-2	Explain the theory of maximum social welfare with diagram.	
Que-3	What is direct tax? Explain the advantages and disadvantages of direct tax. OR	(14)
Que-3	What is Indirect tax? Explain the advantage and disadvantages of indirect tax.	
Que-4	Explain the concept of Impact of taxation, Incidence of taxation and shifting of taxation with help of illustration. OR	(14)
Que-4	Give the meaning of public expenditure and describe the causes of growth in public expenditure.	
Que-5	Write short notes. (any two) (1) Scope of public finance. (2) Principles of taxation. (3) Sources of public income. (4) Principles of public expenditure.	(14)